https://archive.org/details/bk1417/page/n0/mode/1up

2013-12 -Satpanth Prakash (1417)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

વર્ષ : ૨, અંક : ૧૦, સળંગ અંક : ૨૨ દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતું માસિક ડીસેમ્બર : ૨૦૧૩

સતપંથ પ્રકાશ

ગુરુજન સ્મૃતિ વિરાટ શ્રધ્ધાંજલિ સમારોહ એવં અખિલ ભારતીય સંત સમિતિના ચોવીસમા રાષ્ટ્રીય મહાઅધિવેશન પ્રસંગે મંચસ્થ બિરાજમાન પૂ. જગદ્‌ગુરુ શંકરાચાર્યશ્રીઓ, પૂ. જગદ્‌ગુરુ રામાનંદાચાર્યશ્રીઓ, પૂ. જગદ્‌ગુરુ સત્પંથાચાર્યશ્રીઓ, પૂ. આચાર્યશ્રીઓ, પૂ. મહામંડલેશ્વરશ્રીઓ, પૂ. શ્રી મહંતો, પૂ. મહંતો, પૂ. સંત-મહાત્માઓ વગેરે.

ગુરુજન સ્મૃતિ વિરાટ શ્રધ્ધાંજલિ સમારોહ એવં અખિલ ભારતીય સંત સમિતિના ચોવીસમા રાષ્ટ્રીય મહાઅધિવેશન પ્રસંગે સંત સમિતિના અગ્રણીય જગદ્‌ગુરુઓ, આચાર્યો, સંતો વિચાર વિમર્શ કરી રહ્યા છે.

છૂટક કિંમત રૂા. ૯/- વા.લ. રૂા. ૧૦૦/-

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
Page 1 of 16
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1417/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 3, 4, 6, 8, 10, 11, 14.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1417/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 15:01:05 +05'30'

realpatidar.com

વર્ષ : ૨, અંક : ૧૦, સળંગ અંક : ૨૨ દર માસની ૧૫ તારીખે પ્રસિદ્ધ થતું માસિક ડીસેમ્બર : ૨૦૧૩

સતપંથ પ્રકાશ

ગુરુજન સ્મૃતિ વિરાટ શ્રધ્ધાંજલિ સમારોહ એવં અખિલ ભારતીય સંત સમિતિના ચોવીસમા રાષ્ટ્રીય મહાઅધિવેશન પ્રસંગે મંચસ્થ બિરાજમાન પૂ. જગદ્‌ગુરુ શંકરાચાર્યશ્રીઓ, પૂ. જગદ્‌ગુરુ રામાનંદાચાર્યશ્રીઓ, પૂ. જગદ્‌ગુરુ સત્પંથાચાર્યશ્રીઓ, પૂ. આચાર્યશ્રીઓ, પૂ. મહામંડલેશ્વરશ્રીઓ, પૂ. શ્રી મહંતો, પૂ. મહંતો, પૂ. સંત-મહાત્માઓ વગેરે.

ગુરુજન સ્મૃતિ વિરાટ શ્રધ્ધાંજલિ સમારોહ એવં અખિલ ભારતીય સંત સમિતિના ચોવીસમા રાષ્ટ્રીય મહાઅધિવેશન પ્રસંગે સંત સમિતિના અગ્રણીય જગદ્‌ગુરુઓ, આચાર્યો, સંતો વિચાર વિમર્શ કરી રહ્યા છે.

છૂટક કિંમત રૂા. ૯/- વા.લ. રૂા. ૧૦૦/-

realpatidar.com

https://archive.org/details/bk1417/page/n3/mode/1up

realpatidar.com

Nakhtrana
Nishkalanki
Temple - Khana

પંચમ્ વાર્ષિક પાટો... સન્માન સમારોહ - નૂતનવર્ષ સ્નેહ મિલન

...નખત્રાણા (તા. ૧૦-૧૧-૨૦૧૩)

પંચમ્ વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મંચસ્થ બિરાજમાન સંતો-મહંતો-મહાનુભાવો

સરસ્વતી સન્માન સમારોહ પ્રસંગે પુરસ્કાર ગ્રહણ કરી રહેલ બાલમિત્ર

સરસ્વતી સન્માન સમારોહ પ્રસંગે મંચસ્થ બિરાજમાન સંતો-મહંતો-મહાનુભાવો

સરસ્વતી સન્માન સમારોહ પ્રસંગે પુરસ્કાર ગ્રહણ કરી રહેલ બાલિકા

પંચમ્ વાર્ષિક મહોત્સવ એવં સરસ્વતી સન્માન સમારોહ પ્રસંગે સભામાં બિરાજમાન જન-સમુદાય

સરસ્વતી સન્માન સમારોહ પ્રસંગે પુરસ્કાર ગ્રહણ કરી રહેલ બાલિકા

realpatidar.com

Momaymora
Satpanth Khana

realpatidar.com

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ ... : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મમાયમોરા - માંડવી (તા. ૭-૧૧-૨૦૧૩)

ઉપરોક્ત પ્રસંગે સંતોના ભવ્ય સ્વાગત - શોભાયાત્રા

ઉપરોક્ત પ્રસંગે મંચસ્થ બિરાજમાન પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા પૂ. સંતો - મહંતો - મહાનુભાવો

ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં ધર્મલાભ લેતા ભાવિક હરિભક્તો

ઉપરોક્ત પ્રસંગે શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર
વૈદિક મંત્રોચ્ચારસહ દર્શનાર્થે ખુલ્લુ મૂકતા
પૂ. જગદ્‌ગુરુશ્રી તથા અન્ય સંતો

ઉપરોક્ત પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા શ્રી નિષ્કલંકી નારાયણ
ભગવાનના સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહેલ
પૂ. જગદ્‌ગુરુશ્રી તથા અન્ય સંતો

realpatidar.com

https://archive.org/details/bk1417/page/n5/mode/1up

Vajepurkampa Bayad - Satpanth Khana

realpatidar.com

શ્રી [illegible] કડવા પાટીદાર સમાજ અરવલ્લી [illegible] સમુહ લગ્નોત્સવ - તુલસી વિવાહ
સંત માતૃશ્રી કુંવરમા આશ્રમ 'દેવી[illegible]યડ (તા. ૧૪-૧૧-૨૦૧૩)

ઉપરોક્ત પ્રસંગે મંચસ્થ બિરાજમાન સંતો-મહાનુભાવો

ઉપરોક્ત પ્રસંગે પાંચમા સમુહ લગ્નોત્સવના દાતાશ્રીઓ સહપરિવાર

ઉપરોક્ત પ્રસંગે મુખ્ય આમંત્રિત મહેમાનો તથા મહોત્સવ આયોજકો

ઉપરોક્ત પ્રસંગે ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો

realpatidar.com

https://archive.org/details/bk1417/page/n6/mode/1up

2013-12 -Satpanth Prakash (1417)

સત્પંથ પ્રકાશ | ડીસેમ્બર - ૨૦૧૩

વર્ષ : ૨, અંક : ૧૦, સળંગ અંક : ૨૨

realpatidar.com

સત્પંથ પ્રકાશન સમિતિ

સંપાદકશ્રી :
શ્રી શામજીભાઈ કે. પટેલ (વડાગામ)
સહ સંપાદકશ્રી :
શ્રી બાબુભાઈ એસ. પટેલ (મેઘકંપા)
મંત્રીશ્રી :
શ્રી જસુભાઈ કે. પટેલ (વિઠ્ઠલપુરાલાટ)
સહમંત્રીશ્રી :
શ્રી સુરેશભાઈ એમ. પટેલ (અમદાવાદ)
સલાહકારશ્રીઓ :
શ્રી છગનભાઈ એસ. પટેલ (વડોદરા)
શ્રી શામજીભાઈ એલ. પટેલ (વડોદરા)
સદસ્યશ્રીઓ :
શ્રી પ્રિ. સુરેશભાઈ એસ. પટેલ (ખેડબ્રહ્મા)
શ્રી કરસનભાઈ વી. પટેલ (ધનસુરા)
શ્રી મનોજભાઈ એન. પટેલ (વડોદરા)
શ્રી જેઠાલાલ કે. સેંઘાણી (મેરાઉ)
શ્રી અમૃતલાલ જે. રૂડાણી (નાના અંગીયા)
શ્રી બાબુભાઈ એચ. પટેલ (અમરગઢકંપા)
શ્રી હર્ષદકુમાર જે. પટેલ (પીરાણા લાટ)

સત્પંથ પ્રકાશ - લવાજમ દર

		ભારતમાં		વિદેશમાં
વાર્ષિક	:	૮૦=૦૦	:	૭૦૦=૦૦
ત્રિવાર્ષિક	:	૨૨૦=૦૦	:	૧૮૦૦=૦૦
આજીવન	:	૭૫૦=૦૦	:	૪૦૦૦=૦૦
અમર	:	૧૫૦૦=૦૦	:	૭૦૦૦=૦૦

પ્રકાશક

સત્પંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ-૩૮૨૪૨૫. ફેક્સ : ૦૨૭૧૮-૨૮૮૮૭૨
સંપર્ક : ધર્મેન્દ્ર પટેલ - બુકસ્ટોલ મો. ૯૪૨૭૩૭૧૦૪૦ ફોન: ૦૨૭૧૮-૨૮૮૮૧૨

E-mail : kutchkadavasssamajtrust@yahoo.in
kkp_pirana@yahoo.com
(Contact : Mob. No. 9909508029)

Website : www.satpanth.org
www.satpanthprakashan.org
www.nishklankinarayan.com

કુરીયર્સ : હિજેશ પટેલ - મો. ૯૯૭૪૨૬૪૪૪૪ / આશિષ પટેલ : ૯૯૭૪૪૯૦૦૦૨
સત્યમ ઓટો કન્સલટન્ટ
૧-એ, જયવિજય સોસાયટી, ઓ.-પલીયડનગર ગાર્ડન, પલીયડ નગર
સોસાયટીની નજીક, નારણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩
C/o. સત્પંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા.

મુદ્રક : સ્મૃતિ ઓફસેટ : બી-૫/૬/૭, રવિ એસ્ટેટ, રૂસ્તમ મિલ કંપાઉન્ડ, ટોરેન્ટો પાવરની બાજુમાં, દુધેશ્વર, અમદાવાદ-૩૮૦૦૦૪, ફોન : (૦૭૯) ૨૫૬૩૦૩૭૨/૭૩

મૂળ ક્રમ : વર્ષ : ૨૧, અંક : ૨, સળંગ અંક : ૨૪૨

સંપાદકીય.....

પ્રેરણા

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય વિજયેતેતરામ ॥

પોતાની જાતને બીજા સાથે સરખાવતો માણસ સદા દુઃખમાં જ સબડતો રહે છે. પોતાનાથી ચડિયાતા માણસો તેને બહુ જ પ્રભાવિત કરતા હોય છે. તેના કરતાં સવાયા થવાની મહેચ્છા તેને થતી હોય છે. આવી મહેચ્છા રાખવી એ પ્રયત્ન કરી સફળતા મેળવવી તે સારી બાબત છે; પરંતુ બીજાની ઈર્ષા કરવી, બીજાનું સારું જોઈ દુઃખી થવું, પોતાની નિષ્ફળતા માટે બહાના શોધવા, સફળ માણસોના દોષો શોધીને રાજી થવું અને બીજાનું સુખ જોઈ અંદર દુઃખી થવું તે યોગ્ય નથી. બીજાના સારા ગુણોને જીવનમાં ઉતારવા, ગુણગ્રાહી બનવું એ સારું છે, પરંતુ કોઈનું આંધળું અનુકરણ કરવું એ માનવી માટે જીવતું મરણ જ છે. બીજાના જેવા થવાનો દેખાવ કરવો, બીજાની ચાલે ચાલવું એટલે પોતાની જાતે ખાડામાં પડવા જેવું છે. દરેક માણસે પોતાના ગુણધર્મો અનુસાર પોતાના વ્યક્તિત્વને નિખારવું જોઈએ. બીજાની સાથે પોતાની સરખામણી થઈ શકે નહિ. સરખામણી અળખામણી છે. દરેક માણસે પોતાની રીતે જીવવાનું હોય છે. આમાં બીજાની ચાલે ચાલીએ તો મરવાનો વારો આવે. કાગડો હંસની ચાલે ચાલવા જાય તો તે પોતાની મૂળ ચાલ પણ ગુમાવી બેસે. ઈશ્વરે દરેકને પૂરતી શક્તિ આપેલી છે તે શક્તિ પર તેણે પોતાના જીવનનું ઘડતર કરવાનું હોય છે.

પોતાપણામાં મહાલવું એ જ જિંદગીનો અમૂલ્ય લહાવો છે.

માણસ જે કાંઈ છે પોતાના ગુણધર્મોથી તે બરાબર છે, તેને બીજા કોઈ બનવાની જરૂર નથી. દૂરથી જ ડુંગરા રળિયામણા લાગતા હોય છે. બીજાનું બધું સારું લાગે છે અને પોતાની પાસે જે કંઈ છે તેનો અનુભવ થતો નથી.

સંપાદક : શ્રી શામજીભાઈ કે. પટેલ

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1417/page/n7/mode/1up

realpatidar.com

Satpanth Religious Literature - Sadguru Vachanamrut - Gorvaani

સદ્ગુરુ વચનામૃ

- હંસરાજભાઈ ગો. પટેલ - મેઘપુરાકંપા.

ચંચળ ચિત્ત મન સ્થિર કરી ધરો,
ને જગમાં જીવડાની ચિંતા કરો.
કાયા કાચી ગળી જાશે કાલ,
તો આગળ જીવડા કોના હવાલ.
જાગો જાગો મનખા દેહી તમ ધરી,
પણ જીવની ચિંતા એક ન ધરી.
હું હું કરી સર્વ જુગ ખોયા મુરખ તું અંધ,
પણ હવે કલિયુગ છેલ્લી સંધ.

અહીં સદ્ગુરુશ્રી ઈમામશાહ મહારાજ તેમના ભક્તોને સમજાવતાં ચેતવણી રૂપે કહે છે કે; આ ચંચળ ચિત્ત-મનને સ્થિર કરો અને તમારા જીવની ચિંતા કરો. કાલે મૃત્યુ થતાં આ દેહનો વિલય થઈ જશે પછી તમારા જીવના શું હાલ થશે ? શું દશા થશે ? માટે આ મનખા દેહ મળ્યો છે તેને સાર્થક કરી લઈ જીવની મોક્ષગતિ કરી લો. મૂરખ થઈ અંધ બની હું હું કરી આ મહામૂલો મનખા જન્મારો ખોયો - પુરો થઈ ગયો, હવે આ કલિયુગમાં આ છેલ્લો મનુષ્ય જન્મ મળ્યો છે તો હવે ચેતી જવાનો અવસર મળ્યો છે તો ચેતી જાઓ.

સદ્ગુરુશ્રીએ તેમના ઉપદેશમાં મનને સ્થિર કરવાનું કહ્યું છે તો મન સ્થિર કેમ થાય ? પ્રાણાયામ કે કોઈ ગણતરીમાં મનને પરોવીએ તો તેટલો જ સમય મન સ્થિર થાય છે તે માટે જ્યાં સુધી ચંચળ મન વશ ન થાય ત્યાં સુધી ભક્તિ - સેવાપૂજા - ધ્યાન - ધારણા - ધ્યેય - પ્રાણાયામ ત્રાટક કે કોઈપણ બીજી ક્રિયા સાવ નિષ્ફળ થાય છે.

"માળા તો કરમાં ફરે, જીભ ફરે મુખમાંય,
ચતુર્દિશ જેનું મન ફરે તે સ્મરણ નોય."

મન જો જ્યાં ત્યાં ભટક્યા કરતું હોય તો માળા ફેરવવાની કે ભક્તિ કરવાની મહેનત વ્યર્થ જાય છે. માટે જો એક જ મન વશ થાય તો નવે નવ ઈન્દ્રિઓ વાસના કરતી બંધ થઈ જાય છે. કેમ કે નવ ઈન્દ્રિયની લગામ મનના હાથમાં છે. તે પછી પ્રેમલક્ષણા દસમી ભક્તિમાં મન લાગી જાય છે તો પરમતત્ત્વ કે જે તે પોતે

આત્મા છે તેની પ્રતિતિ થવા લાગે છે.
...શ કરવાનો ઉપાય પણ સંતોએ બતાવ્યો

કરી લ્યો શ્વાસે શ્વાસથી મેળ, રહો હોઈ સ્વરને જોડી, દૂર દેખ ન મત જાઓ. કોઈ પકડો સુરની દોરી, શ્વાસ ઉશ્વાસ વસે તારી દેહમાં, તેની કરી લેને ઓળખાણી."

શ્વાસ ઉશ્વાસની સાધનાથી કોઈ શૂનમાં પહોંચ જાય. આપણામાં શુધ્ધ અદ્વૈત જ્ઞાન ગંગા છે તેમાં નાહી લો, એ ત્રિવેણી છે. જ્યાં ત્રિવેણી સંગમ થાય છે તેજ શ્વાસ-સુરતા-શબ્દ ત્રિવેણી સંગમ છે. ત્યાં કાયમ મનને રાખો. જેથી કરી બહાર વિષયોમાં ભટકતું મન સ્થિર થતું જશે.

મનની હારે હાર હૈ મનકી જીતે જીત,
મન મિલાવે રામસુ મન કરે ફજીત.
મનકા કહ્યા ન કીજીએ મન છે હરાયુ ચોર,
મન કપટી મન લાલચુ, મન ચંચળને ચોર.

મન પોતાને વશ રહેવું જોઈએ તો તે ગુલામ બની આપણું કાર્ય કરે છે. સદ્ગુરુશ્રી આપણને જાગવાની વાત કરે છે. વાસ્તવિક રીતે રાત્રે જાગી ભક્તિ કરવી તે ઠીક છે પણ આ મહામૂલો મનુષ્ય અવતાર માત્ર જન્મ મરણના ફેરાથી મુક્ત થવા મળ્યોછે. માટે આ જન્મે જ જીવની મોક્ષગતિ મુક્તિ થવી જોઈએ. આ ઉપદેશ થકી સદ્ગુરુશ્રી તે વાતે જાગવાની વાત કરે છે. માટે કાળરૂપી મૃત્યુ ક્યારે થશે ? કાળ આપણને ક્યારે લઈ લેશે તે નક્કી નથી તો તે પહેલાં જાગી જાઓ - ચેતી જાઓ. મૃત્યુ પછી જીવાત્માનાશું હાલ થશે તે કોઈને ખબર છે ? જો નહીં ચેતો તો ચોરાસીના ચક્કરમાં ફરી ફરી અવતાર્યા કરવું પડશે, અનેક યાતનાઓ ભોગવવી પડશે.

માટે આ કલિયુગમાં છેલ્લો આ મનુષ્ય દેહ મળ્યો છે, તો આ જગતની ખોટી મોહ-માયામાં 'હું-હું' પણામાં રહી આ અમૂલ્ય જીંદગી વેડફી ન દેવાય તેનું ધ્યાન રાખશો. "**સહસ્ત્ર પચાસા ભોગવી મળ્યો આ મનુષ્ય દેહ,"** પચાસ હજાર વર્ષના અંતે માંડ કરીને મનુષ્ય જન્મ મળ્યો છે. તો આ જન્મે જ મોક્ષ મુક્તિ કરી લઈ આવાગમનથી ચોરાસીના ચક્કરથી બચી જાઓ અને જીવની મોક્ષ મુક્તિ કરી લો.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1417/page/n8/mode/1up

realpatidar.com

જુગો જુગના ભૂલા કલિયુગે મલીયા,
પણ કલિયુગના ભૂલા તે નરકે જાઈયા.
જેના પૂર્વે સંચે સદ્‌ગુરુ મળીયા,
તેના ભવસાગરના ફેરા ટળીયા.
સદ્‌ગુરુ મલીયા તો રાખો ઈમાન,
તો સ્વામીનું એકચિત્તે ધરો ધ્યાન.
કહેત ઈમામશાહ સુણો મુનિવરો,
તો ગત ગંગામાં મલતાં ન કીજે વાર.

અહીં સદ્‌ગુરુશ્રી ભક્તોને ઉપદેશ આપતાં કહે છે કે જુગો જુગના ભૂલ્યાં જીવો આજે કલિયુગમાં આવી મળ્યા અને કલિયુગમાં ભૂલ્યા જીવ નરકે જશે. પહેલા કર્તાયુગમાં જે જીવોની મોક્ષગતિ ના થઈ તે ચોરાસીના ચક્કરમાં આવી ત્રેતાયુગમાં આવ્યા. ત્રેતામાં જેની મુક્તિ ના થઈ તે દ્વાપરયુગમાં આવી ફરી જન્મ ધારણ કરવો પડ્યો અને દ્વાપરયુગમાં ભક્તિ ના કરી તેવા ભૂલેલા જીવો આજે કલિયુગમાં ફરી અવતાર જન્મ ધારણ કર્યો. હવે આ કલિયુગમાં આ મનુષ્ય જન્મે મોક્ષગતિ જે જીવાત્માઓની થશે નહીં તેને નરકે જવાનો વારો આવશે.

પૂર્વેના જેના ભાગ્ય હશે જેને સાચા સદ્‌ગુરુ મળ્યા હશે અથવા મળશે તેને સાચો ભક્તિનો રાહ મળશે અને તેવા જીવાત્માની મોક્ષ મુક્તિ થશે. જેથી કરી તેવા જીવોને આવાગમન રહેશે નહી. જેથી સાચા સદ્‌ગુરુનું શરણું લઈ તેની પાસેથી સદ્‌જ્ઞાન મેળવી આ જન્મે આ જીવની મોક્ષ મુક્તિ મેળવી લેવી જોઈએ. જે ગુરુ - સદ્‌ગુરુ ઉપદેશ આપે જ્ઞાન આપે તે ઉપદેશને વળગી રહી તેમાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખી તેનું અનુકરણ કરવું જોઈએ તેમણે બતાવેલા માર્ગનું પરમાત્માનું એક ચિત્તે ધ્યાન ધરવું જોઈએ. સાચા હૃદયથી અંતઃકરણથી પરમ તત્ત્વમાં પરમાત્મામાં એકરૂપ થઈ જશો. ઓતપ્રોત થઈ જશો તો પ્રભુની તમારા પર કૃપા થશે અને પરમાત્માનો સાક્ષાત્કાર અનુભૂતી થશે જેથી કરી જીવની મુક્તિનો માર્ગ સરળ બની જશે અને મોક્ષમુક્તિ થશે.

આ રીતના સદ્‌ગુરુશ્રીના બતાવેલા ઉપદેશનું નિત્ય પાલન કરતાં-કરતાં જીવન બદલાઈ જશે અને તમો સત્યની નજીક જશો. સાથે સાથે બતાવેલા ટેક-નિયમનું પાલન કરતા જવું - નિત્ય દેવદર્શન માટે ગતગંગામાં મંદિરોમાં જઈ આરાધના પ્રાર્થના કરવી જેથી મુક્તિનો રસ્તો સરળ બને. ચોર્યાસીના ચક્કરમાં જન્મવું - મરવું તે કેટલું દુઃખદાયક છે તે વાત આપણા પર આ માયાના આવરણો ચડી જવાથી ભૂલી ગયા છીએ.

શાંત ચિત્તે - ધ્યાનમાં બેસી વિચારો કે આ સૃષ્ટિમાં અવતરેલા દરેક યોનીના જીવાત્માઓ કેટલા દુઃખી છે - કેટલી યાતનાઓ ભોગવી રહ્યા છે. ક્યારેક તો તેવી યોનીમાં આપણો જીવાત્મા આવેલ હશે અને આપણા જીવની મુક્તિ ના થઈ તો તેવી યોનીઓમાં ભટકવાનો વારો પણ આવશે. ત્યારે આપણું શું થશે ? કેટલી વિનંતી પ્રાર્થનાઓના અંતે માંડ કરીને આ મનુષ્ય જન્મ મળ્યો અરે ! આપણે અથવા કોઈ પણ મનુષ્ય પણ મનુષ્ય અવતારમાં સુખી છે ? દરેકને કોઈ પણ દુઃખો તકલીફ છે. તો જો મનુષ્ય જન્મમાં જ આપણે સુખી નથી તો બીજા કોઈપણ જન્મમાં સુખ મળે ખરું ? ના, તો સદ્‌ગુરુશ્રીએ બતાવેલા સત્ય માર્ગનું પાલન કરી આ જન્મે જ આપણાં જીવને જન્મ મરણની ચુંગાલમાંથી છોડાવી લઈ મુક્ત કરી દો તો આપણો આ મનુષ્ય જન્મનો ફેરો સફળ થયો લેખાશે. ●●●

વિજ્ઞપ્તિ

પ.પૂ. ગુરુવર્ય સંતશ્રી પ્રેમદાસબાપુ શિષ્ય મંડળ જોગ

સહર્ષ જણાવવાનું કે શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી અને સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની પરમકૃપાથી તેમજ પ.પૂ. ગુરુદેવના આશીર્વાદથી પ.પૂ. ગુરુવર્ય સંત શ્રી પ્રેમદાસબાપુની "વાર્ષિક મહાપૂજા તેમજ શિષ્ય મિલન સમારોહ" દહેગામ મધ્યે સં. ૨૦૭૦, માગશર વદ - ૫, રવિવાર, તા. ૨૨-૧૨-૨૦૧૩ના મંગલ દિને રાખવામાં આવેલ છે. જેની પ.પૂ. ગુરુવર્ય સંત શ્રી પ્રેમદાસબાપુના સમગ્ર શિષ્યમંડળે નોંધ લેવી.

સ્થળ : શ્રી નિલકંઠ મહાદેવ, દહેગામ-રખિયાલ રોડ, મુ. દહેગામ.
સંપર્ક : શ્રી અરવિંદ પટેલ - મો. ૯૭૨૨૬૦૫૪૯૫
શ્રી ચિલ્કેશ પટેલ - મો. ૯૮૨૫૭૨૧૨૫૨

realpatidar.com

https://archive.org/details/bk1417/page/n9/mode/1up

2013-12 -Satpanth Prakash (1417)

Satpanth Religious Literature - Manchintamani

realpatidar.com

સદ્‌ગુરુનો દિવ્ય સંદે

(મનચિંતામણી માંથી)

પ.પૂ. મહંતશ્રી શામળદાસજી મહારાજ,
પ્રેરણાપીઠ - પીરાણા.

ભીતર ભેદની વિદ્યા ખરી;
જેણે બેસે મન ઠામે ઠરી....... ૧
ભીતર ગળે વાસના લીંગ,
નિવર્ત પામે સઘળાં અંગ...... ૨
શ્રીમુખ સ્વામી કહે છે એહ,
ભીતર સમજે તે પુરુષ વિદેહ... ૩
એમ લક્ષણ હૃદયમાં ધરીએ,
અંતર માંહેથી દ્વિત પરહરીએ... ૪
પૂરણ ભાગ્યે મુનિવરે લહ્યું,
શ્રીમુખ સ્વામીએ એમ જ કહ્યું... ૫
તું હી સાચા સાહે હો....
શ્રીમુખ નારાયણ કહે, બ્રહ્મજ્ઞાન મુખ વાણ...
સબ ઘટ સાહેબ એક છે, આદિ અંતે નારાયણ.

સદ્‌ગુરુ કહે છે કે; જે ભેદની વિદ્યા છે તે અંદર છે. સારું પણ શરીરની અંદર છે, ખરાબ પણ શરીરની અંદર છે. લોહી પણ અંદર છે, મળમૂત્ર પણ અંદર છે. આ થઈ શારીરિક વાત. આધ્યાત્મિક વાત કરીએ તો સ્વર્ગ અંદર છે, નર્ક અંદર છે, મોક્ષ અંદર છે, બંધનનો ભેદ અંદર છે એટલે બધા જ ભેદની વિદ્યા આપણા શરીરની અંદર છે. જે વિદ્યા દરેકને પ્રાપ્ત થતી નથી. તેવી જ રીતે લીંગ વાસના પ્રથમ અંદરથી થાય છે પછી બહારની ઈન્દ્રિયોથી થાય છે. અંદરથી જ જો વાસના ન થાય તો બહારની પાંચેય ઈન્દ્રિયો નિવૃત્તિ પામે છે માટે મનને સમજાવીને અંદરથી લીંગ વાસનાનો ભંગ કરવાનો છે. **"લીંગ વાસના થાય ભંગ તો કકા કર સદ્‌ગુરુનો સંગ."** એટલે અંદરના વૈરાગ્યની પ્રથમ જરૂર પડશે. બહારની ઈન્દ્રિયોને સમજાવવી નહિ પડે. બહારની ઈન્દ્રિયો સેવક છે.

સ્વામીજી આપણને એ જ વાત કહે છે કે જે અંદરથી સમજે છે તે જ પુરુષ વિદેહી છે. જેમ ...થી સમજી ગયા હતા. પોતાનો રાજ ...હતો છતાં અંદરથી બિલકુલ દુઃખી ન હતા લોકોએ આવીને સમાચાર આપ્યા કે તમારો મહેલ સળગી રહ્યો છે છતાં સહેજમાત્ર વિચલીત નહોતા થયા કે મારે મહેલ હોય તો પણ શું અને ન હોય તો પણ શું. કારણ કે તે વિદેહી હતા અને અંદરની સમજવાળા હતા. જનક રાજાની આટલી સાહ્યબી હતી છતાં તેમાં તેને મોહ ન હતો, ત્યારે આપણે થોડી મિલકત માટે ઝઘડા કરીએ છીએ. કેટકેટલાય લોકો મિલકત માટે ખૂન કરી નાખે છે. તો આપણે પણ જનક રાજાના જીવન પરથી બોધ લઈ તેમનાં લક્ષણ અંદર હૃદયમાં ઊતારવાં જોઈએ અને અંદરથી દ્વૈત પરહરવું જોઈએ. દ્વૈત એટલે જુદાપણું. આ મારું આ તારું આ જુદાપણું છે. બધું જ આપણા બધાનું છે કે ભગવાનનું છે તે સમજે તે એકતા છે અદ્વૈત છે. અદ્વૈતવાદનું વિવેચન ઘણું જ ગહન છે, કે બધા જ જીવમાં એક જ પરમાત્મા વસી રહ્યો છે. હું પોતે પરમાત્માનો અંશ છું અને આ સમગ્ર જગતના જીવો છે તે પરમાત્માના અંશો છે માટે હું અને જગતના બધા જીવો એક જ પરમાત્માના અંશો છીએ માટે એક જ છીએ તો તેમને મરાય નહિ તેમની સેવા થાય. તેમને મારતાં પોતાને લાગે એવી મનમાં વેદના થવી જોઈએ. અદ્વૈતવાદ વિષે વધુ લંબાણમાં ન જતાં આપણે અંદર હૃદયથી દરેકને માન આપવું જોઈએ અને દ્વૈત દૂર કરવું જોઈએ. પૂજાના મંત્રમાં આવે છે : **"ઐક્ય કરો દ્વૈત દૂર કરો."** જે પૂરણ ભાગ્યશાળી મુનિવર હશે, તે આ જ્ઞાન લેશે આપણા સ્વામી મહારાજ પણ એમ જ કહે છે.

તું જ સાચો સાહેબ, સાંઈ પરમાત્મા છે. શ્રી નારાયણ ભગવાન એમ કહે છે કે બધા જ શરીરોમાં હું નારાયણ છું. આદિ પણ હું છું અને અંત પણ હું છું. ભાગવતમાં આખો અધ્યાય આ વિષે છે. સર્વ જડ ચેતનમાં હું છું.

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1417/page/n10/mode/1up

realpatidar.com

સદ્‌ગુરુ ઉપદેશ

- અંબાલાલ પી. પટેલ, લક્ષ્મીપુરાકંપા - બાયડ.

સદ્‌ગોર કહે રે મનુષ્ય દેહ પામ્યો તો ક્યા પાયા,
અને ન જાણ્યા મુક્તિના ભેદ રે.

માણેક મોટા તો ક્યા હુઆ, જેને અંતર ન પડીયા છેદ રે...

સદ્‌ગોર કહે છે કે; તને મનુષ્ય અવતાર મળ્યો છે તો મુક્તિનો ભેદ મેળવી લે. મનુષ્ય અવતારમાં બધું જ શક્ય છે. "જ્ઞાની સે જ્ઞાની મીલે કરે જ્ઞાનકી બાત, ગધે સે ગધા મિલે કરે લાતમ્ લાત." મનુષ્ય જન્મમાં જ્ઞાન મેળવીએ છીએ. જ્ઞાન નહીં મેળવીએ તો પછી બીજા અવતારોમાં લાતમ્ લાત જ કરવાની છે. તો જ્ઞાની ગુરુ ગોતી લઈ તેના વચને ચાલો તો મુક્તિ મળશે. પરમાત્મા સંતોને મનુષ્ય રૂપ લઈ ઉપદેશ આપવા મોકલે છે. કારણ કે માણસ જ માણસની ભાષા સમજી શકે. કોઈ દેવ રૂપે આવીને તે આપણને જ્ઞાન આપે તો સમજી શકીએ નહિ. માટે માનવ રૂપે અવતાર લઈ સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજ જેવા સદ્‌ગુરુને જગતના લોકોને મુક્ત કરવા મોકલેલ છે. અત્યારે સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ હાજર નથી તો તેને બતાવેલ માર્ગ તથા તેને જાણનારા, માનનારા ગુરુ પાસેથી ઉપદેશ (બોધ) લઈ મુક્ત થઈ શકાય.

માણેક મોટું હોય, કિંમતી હોય પણ આખું ન ચાલે તેને કોતરવું પડે તો મણકા બની પરોવાઈ શકાય.

"ઘોડો ભાંગ્યો ખેલતાં, મન ભાંગ્યું કવેણ,
મોતી ભાંગ્યું વીંધતાં, નહિં સાંધો નહિં રેણ."

મોતીને વીંધવું પડે તેમ આપણા અંતરને પણ વીંધવું પડે. આપણું હૃદય નિર્મળ બનાવવું પડે તેમાં આપણો અહંકાર કાઢી પ્રભુનો અહંકાર ભરવો પડે. આપણા વિચારો જ્ઞાન કરતાં સંતોનું જ્ઞાન ઊચું છે, તેના વચન પ્રમાણે ચાલવું પડે. આપણી મોટાઈ, અહંકાર, માન, મરતબો ત્યજવાં પડે તો પ્રભુ પ્રાપ્ત થાય. બીજાને ઉપયોગી બનવું પડે.

સદ્‌ગોર કહે રે મનુષ્ય દેહ તો દુર્લભ છે,
તે તો નહિ આવે વારંવાર રે...

પાત્ર પીછાણી પરિબ્રહ્મ પૂજીએ, તો કુળનો હોય નિસ્તાર રે...

સદ્‌ગોર આપણને વારંવાર આ વાક્ય બોધ કહે છે કે; મનુષ્ય દેહ દુર્લભ છે એટલો બધો સહેલો નથી કે ઝટ દઈને પ્રાપ્ત થઈ જાય "જેવી કરણી તેવી ભરણી." માટે અત્યારે જે મનુષ્ય દેહ મળ્યો છે તેનો પૂરેપૂરો સદુપયોગ કરી લો. કેવી રીતે ? તો કહે છે; **"પાત્ર પીછાણી પરિબ્રહ્મને પુજીએ"** એટલે સદ્‌ગોર પાત્રને ઓળખી લો. પાત્રને ઓળખવું બહુ જ મુશ્કેલ કામ છે. છતાં મનની પ્રબળ ઈચ્છા હોય તો જરૂર ઓળખી શકાય અને પૂજવાનું પરિબ્રહ્મને છે. ઈમામશાહ મહારાજ સદ્‌ગોર પાત્ર બ્રહ્મા હતા તો તેમને પૂજો તો આપણું એકનું નહિં પણ આખા કુળનો ઉધ્ધાર થાય. નરસિંહ મહેતા કહે છે **"ભણે નરસૈયો એનું દરશન કરતાં કુળ ઈકોતેર તાર્યા છે."** તે જ પરિબ્રહ્મે આપણા આ દેહમાં વાસ કર્યો છે તો શ્વાસમાં અથવા ત્રિકુટીમાં ધ્યાન લગાવી સદ્‌ગુરુએ બતાવેલ મંત્રનો જાપ જપતાં આપણા શરીરમાં રહેલા પરિબ્રહ્મને પૂજીએ તો પણ કુળનો નિસ્તાર થાય...(અહીં નિસ્તાર એટલે ઓધાર થાય.) ●●●

ઉમા મોટર્સ

રાજેશ પટેલ મો. ૯૭૨૪૪ ૬૨૨૨૨
ધીરજ પટેલ મો. ૯૮૭૯૨ ૫૫૯૦૨
મુકેશ પટેલ મો. ૯૯૯૮૭ ૧૭૨૭૦

કાર લે-વેચ માટે મળો.
(ઓટો કનસલ્ટન્ટ)

જી-૧૩, શ્રીજી કોમ્પલેક્ષ, નવરંગ સ્કૂલ રોડ,
શ્રીજી ડેરી નજીક, પલિયડનગર ચાર રસ્તા,
નવરંગપુરા, અમદાવાદ - ૧૪

realpatidar.com

email: mail@realpatidar.com

https://archive.org/details/bk1417/page/n11/mode/1up

2013-12 -Satpanth Prakash (1417)

realpatidar.com

Satpanth Religious Literature - Sadguru Vaani

સદ્ગુરુવાણી

ો મલોને સતે ચાલજો, જુઠુ કરો સર્વે દૂર,
ૂપંથ સેવતા તો મલે, તો નિર્મલ પીજે નૂર.

નૂર પીજીએ નામ લીજીયે, મન નિર્મલ ઊજલુ થાયે,
કામ ક્રોધ મત્સર તેને વારીયે, તો સહી અમરાપુર જાયે.

કામ ક્રોધ શહર લૂંટ્યું, અને લૂંટ્યો સર્વે ભંડાર,
હીરા રતન જવ્હેર લૂટીયા, તેણે લૂંટી વસ્તુ અપાર રે.

મુરખ હૃદયમાં ન જાગીયો, તેણે વસ્તુ ખોઈ અપાર,
જયારે આખર દાડો આવશે, કેમ કરી દેસો જવાબ.

તેણે ચોર કહીને બાંધસે, અને દેસે ઘણનો માર,
હઈડામાંથી અગની પરજલે, જીવડો કરસે પોકાર.

જે સતી કહવેને અનસતી હોવે, તેના ફેરાવન જેવા મુલ,
જે ઈમાન વના ઊખડી ગયા, તેણે મોઢે પડશે ધુલ.

સત્પંથ લઈને ઓતલી ગયા, અને તે પાકી હાંડી તોલ,
ટકોરા દેતા ટુક્કા ભયા, તેણે જમીન આસમાન સગ્રે ન કોય.

સત્પંથ લઈનેઅલગા રહે, તેણે લાગો લીલનો પાપ,
વસ્તુ હતી તે લૂટાઈ ગઈ, પાછે ખાલી રહા હાટ.

કર્મે કાલા તે સદાયે કાલા, અને જ્ઞાન વિચારી જોય,
દુધે ધોયે કોયલા, તો કધી ના ઊજલા હોય.

કહેત ઈમામશાહા સુણો મુનિવરો, અને રાખો આપણું આપ,
ખોટા કરતવ તમે કરસો, તમને ખાશે બીછુ ને સાપ.

●●●

જીવનનું સૂત્ર પકડીએ...

- રવજીભાઈ રતનશીભાઈ ચોપડા - કાનપુરાકંપા.

જીવનને બદલવું જ હોય તો મોટાં મોટાં શાસ્ત્રો, પુસ્તકોના થોથાં કે લાંબા લાંબા ભાષણો, પ્રવચનો વાંચવાની કે સાંભળવાની જરૂર નથી. બસ એકાદ કોઈ સૂત્ર પકડીને ચાલવાનું શરૂ કરીએ તો પણ સંતોના વચનો એવા હોય છે જે સત્ સુધી પહોંચાડી દે છે. એકાદ વચન, એકાદ નાના મંત્ર જેવું વાક્ય જો જીવવા માટે પસંદ કરી લેવામાં આવે તો એ છેક શિખર સુધી લઈ જાય છે.

●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 10 of 16

https://archive.org/details/bk1417/page/n12/mode/1up

realpatidar.com

સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજ રચિત "શ્રીમદ્ ભગવત્ દશાવતાર"

પ્રણ કલ્પની ટૂંકમાં સમજ

Satpanth Religious Literature - Shrimad Bhagwat Dashavatar written by Imamshah

(ગતાંકથી ચાલુ..)

ગુણવિશિષ્ટ સદ્‌ગુરુ મહારાજને અનેકવાર વંદન.

પ્રથમ નિલવર્ણ ધંધુઃકાર આવા મહદાકાશમાં નિર્ગુણ નિરાકાર નિરંજન નારાયણ સ્વયં પ્રકાશ જ્યોતિ સ્વરૂપથી સ્થિર થતા, આ સત્-ચિત્ત બ્રહ્માનું રૂપ એક સંકલ્પથી સ્ફુરણા થયું કે આપણે અનંત રૂપથી પ્રગટ થઈએ. **"બહુસ્યાં પ્રજાયેય"** પરિવર્તનશીલ આવા કાલચક્રમાં ગતિ આપવી અને તદ્‌નુસાર નારાયણનું પ્રથમ સ્ફુરણાથી "ૐ" આદ્યાક્ષર બીજ મંત્ર નિર્માણ થયો. એ પછી અનંતકાળ અનંતયુગ નીકળી ગયા તો પણ એ પરમેશ્વર નિર્ગુણ નિરાકાર સ્વયં પ્રકાશપૂર્ણ જ્યોતિ સ્વરૂપથી સ્થિર હતા. એ વખતે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશાદિ પંચમહાભૂત અને એવં કોઈપણ તત્ત્વ ઉત્પન્ન થયેલ ન હતું. એ બધુ એ પરબ્રહ્મ નારાયણમાં સમાવિત હતાં.

નિલ પ્રશાંત ધુંધ આવા ધુંધુઃકારમય વાતાવરણમાં ધ્યાન કરીને આ આદિપુરુષે આપણા પોતાના સ્વરૂપનું જાણ કરવા માટે મનમાં હેત ધારણ કરી સંકલ્પ કરી બ્રહ્મજ્ઞાન પ્રકાશિત કર્યું. આ જ્ઞાનના યોગથી આ આદિપુરુષ પોતાનું જ સ્વરૂપ ઓળખીને તે પ્રગટ કરવા માટે અથવા મનની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે અનંતકાળ સુધી અજંપા જાપ મંત્રનો જાપ કરવા લાગ્યા. આ રીતે અજંપા જાપથી સ્મરણ કરતા સત્તર લાખ કરણ વર્ષો આટલો દીર્ઘ કાલાવધી સર્ગકાળ નીકળી ગયો.

આ આદિ પુરુષ આપણા જ નિરૂપમય સ્વરૂપમાં સ્થિર હતા, એણે પોતાના જે કરકમળમાં પોતાના જ બિંબનું ધ્યાન કર્યું. સત્તર હજાર યુગ સુધી એકાગ્ર દૃષ્ટિ કરીને આ કરકમળમાં બિંબનું આ નારાયણે નિર્મલ રીતથી ધ્યાન ધર્યું. પછી એ જ પોતાનું બિંબ નાભિકમળમાં સ્થાયી સ્થાપન કરીને એમના જ હાથથી એને બાફ (શક્તિ) આપીને નાભી કમળની ઉત્પત્તિ કરી ... માંથી આદ્ય નિરંજન વિ... કમળનું રૂપ સ્થાપન કરે... ગ્રહણ કરીને ચતુર્મુખ બ્ર... થી અનંત આવા બ્રહ્મલીલાની ઉત્પત્તિ થઈ. એ જ સદ્‌ગુરુ બ્રહ્મા એટલે બ્રહ્મરૂપ સદ્‌ગુરુ થયા.

છત્રીસ યુગ અને ચોર્યાસી ચોકડી આટલા કાળ સુધી બ્રહ્મા પોતાના જ ધ્યાનમાં મગ્ન હતા તે પછી મત્સ્ય નિરાલંભ ઉપર આસન સ્થિર કરીને બ્રહ્માએ પરમાત્માના રૂપનું ધ્યાન કરી બ્રહ્મદેવ આ પરમ પુરુષોત્તમ નારાયણને હાથ જોડીને કહેવા લાગ્યા; 'હે સ્વામી ! શુન્યકાર આવા અખિલ વાતાવરણમાં આપણે બંને જ છીએ. મારા ઉત્પત્તિકર્તા માતા અને પિતા તમે જ નિરંજન નિરાકાર છો., સ્વામી ! આ શરીર કોણે, કેવી રીતે અને શા માટે નિર્માણ કર્યું એ કૃપા કરીને કહો.' બ્રહ્મદેવની આર્તવાણી સાંભળીને નારાયણે એમને કહ્યું કે; 'હે બ્રહ્મદેવ ! તમારુ આ શરીર મેં જ સંકલ્પમાત્રથી સૃષ્ટિ નિર્માણ કરવા માટે કરેલ છે. આવું કહીને નારાયણે બ્રહ્મદેવને દીક્ષા આપીને મંત્ર જાપનો ઉપદેશ કર્યો. તેમાંથી જ વેદોની ઉત્પત્તિ થઈ.'

બ્રહ્મદેવે પ્રણવબ્રહ્મ "ૐ" આ મંત્રનો પોતાના હૃદયમાં મુકીને ધ્યાન કરીને વેદોની ઉત્પત્તિ કરવાનો સંકલ્પ કરતાં જ નારાયણે બ્રહ્મદેવને તત્ત્વોપદેશ કર્યો અને આ તત્ત્વોપદેશથી વેદોની ઉત્પત્તિ થઈ. આ રીતે નારાયણે બ્રહ્મદેવને પ્રવૃત્તિ અને નિવૃત્તિ માર્ગનું દર્શન કરાવ્યું. નારાયણ બોલ્યા; 'હે બ્રહ્મદેવ સાંભળો, આ તત્ત્વોપદેશ ગ્રહણથી સંકલ્પમાત્રથી તમે સૃષ્ટિનું નિર્માણ કરી શકશો અને આ જ તત્ત્વોપદેશના ગ્રહણથી તમે સર્વકર્મ દોષથી મુક્ત થશો. આનાથી અનુપમ કોઈ બીજી વાત નથી. કુદરત અથવા ઈશ્વરી યોગમાયા જગતની ઉત્પત્તિનું આ રહસ્ય ઘડી કાઢે છે. હે બ્રહ્મદેવ, જગતમાંથી મુક્ત થવા માટે આ આત્મજ્ઞાનરૂપ યુક્ત

realpatidar.com

https://archive.org/details/bk1417/page/n13/mode/1up

2013-12 -Satpanth Prakash (1417)

realpatidar.com

સાધનનો યુગો યુગો સુધી અલગ અલગ ઠેકાણે અલગ રૂપથી પ્રગટ થઈ ઉપદેશ કરો.' આવું નારાયણે બ્રહ્મદેવને કહ્યું.

બ્રહ્મદેવ હાથ જોડીને કહેવા લાગ્યા; 'હે પરમાત્મા ! આપના વચન પ્રમાણે મૃત્યુલોકમાં જઈ આમુક્તિના તત્ત્વનો ઉપદેશ કરીશ. સ્વામી ! તે જીવાત્માઓને તત્ત્વોપદેશ કરીને કર્મ, ભક્તિ તથા જ્ઞાનયોગની સાધનાની યુક્તિ એવા મુક્તિ માર્ગનું દિગ્દર્શન કરીશ એ બધા જીવાત્મા ઉપર કૃપા કરીને તમે એ બધાને મુક્તિમાર્ગના અધિકારી બનાવશો.'

ત્યારે નિરંજન નારાયણે કહ્યું કે; હે બ્રહ્મદેવ, એ બધા જીવાત્માને મુક્તિમાર્ગનો અધિકાર કરીશ, પણ એ બધા જો તમારા એટલે કે સદ્દગુરુના માર્ગદર્શન પ્રમાણે પૂર્ણપણે યોગમાર્ગનું તથા યુગધર્મનું આચરણ કરશે, યુગધર્માનુસાર પ્રાધાન્યભૂત વૈદિક ક્રિયાચરણથી યુક્ત થઈને એમનું જ આચરણ કરશે, તે આ નિરંજન નિરાકારના ધામમાં આવી પહોંચશે. હે બ્રહ્મદેવ, 'મારું આ વચન તમે પૂર્ણપણે સત્ય માનો અને આ પ્રમાણે મુક્તિની યુક્તિ કરી તેનું માર્ગદર્શન તમે આ મૃત્યુલોકમાં જીવાત્માને આપો તથા આ માટે તમે મૃત્યુલોકમાં અવતાર ગ્રહણ કરી આવા ગહન અને ગૂઢ તત્ત્વનો ઉપદેશ કરો.'

બ્રહ્મદેવ અનન્ય ભાવથી નારાયણના ચરણે મસ્તક નમાવી અને તે મૃત્યુલોકના જીવાત્માઓને મુક્તિ મળે તે માટેનાં સાધનનો વિચાર કરવા લાગ્યા. તેમાં જ વીસ યુગ નીકળી ગયા. પછી મનમાં વિચાર કરી સંકલ્પ કરીને બ્રહ્મદેવે ધ્યાન ધર્યું અને આકાશ નિર્માણ કર્યું. આકાશથી તેજ અથવા નૂરનું નિર્માણ કર્યું, તેમજ તેમાંથી સૂર્ય ચંદ્રનું નિર્માણ કરીને તે તેજ એમને આપ્યું. પછી તેજમાંથી વાયુ નિર્માણ થઈને વાયુથી પાણી નિર્માણ થયું અને પાણીમાંથી પૃથ્વી નિર્માણ થઈ. આ રીતે અનંત યુગના કાલાવધીત આ પંચમહાભૂત નિર્માણ કરીને સૃષ્ટિની ઉત્પત્તિ કરી. આ બધું નારાયણ પાસેથી બ્રહ્મદેવને પ્રેરણા થઈ અને બ્રહ્મદેવે સંકલ્પ કરી નિર્માણ કર્યું. પણ પોતે નારાયણ આ અલક્ષ્ય નિરંજન નિરાકાર સ્વરૂપથી બધાથી અલિપ્ત રહ્યા.

સદ્દગુરુ બ્રહ્મા પાસેથી એટલે બ્રહ્મદેવ પાસેથી સકળ સૃષ્ટિનું મંડાણ રચાતું ગયું. સૃષ્ટિ ગુરુ બ્રહ્માએ ઈચ્છા માત્ર કરીને ચાર ખાણી, ચાર વાણી, અને ચાર વેદોની રચના કરીને સ્વેદજ, અંડજ, ઉદ્દબીજ અને જરાયુજ આ ચાર ખાણીમાં પ્રત્યેકને એકવીસ - એકવીસ લાખ આવા ચોર્યાસી લક્ષ જીવયોનીની રચના કરીને આ સૃષ્ટિની ઉત્પત્તિ અને રચના ઘડી કાઢી. પહેલા આઠ લાખ કરણ એટલા દીર્ઘકાળમાં બ્રહ્માએ ૧૩ અવતાર ધારણ કર્યા. (બ્રહ્મા નિશ્ચળ, સ્થિર અને ધ્યાન મગ્ન રહીને સૃષ્ટિને ઉત્પત્તિ અને રચનાદીક કાર્ય ઘડવા માટે બ્રહ્મદેવે ૧૩ માનસપુત્રની ઉત્પત્તિ કરી.) એમના જપ, તપ, કર્મ, ભક્તિ, જ્ઞાન, વ્રત, ઉપવાસ આદિ અનેકાનેક સાધનોથી અનંતકોટી જીવોનો ઉદ્ધાર થયો.

(વધુ આવતા અંકે...)

દિનેશ પટેલ - ૯૪૨૭૬ ૯૯૭૮૪
૯૭૨૫૭ ૩૩૬૮૩
જયેશ ભગત - ૯૮૨૫૩ ૮૮૧૬૬

ઓમ ટાયર્સ એન્ડ કાર એસેસરીઝ apollo
દરેક પ્રકારના ટાયર-ટ્યૂબ્સ અને કાર એસેસરીઝ માટે મળો.
૯, અશ્મી શોપીંગ સેન્ટર, મેમનગર ફાયર સ્ટેશન સામે, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૯.
ફર્મ : હરિઓમ એન્ટરપ્રાઈઝ (કપચી, ગ્રીટ સપ્લાયર્સ) મારૂતિ ઈન્વેસ્ટમેન્ટ (શેર લે-વેચ એડવાઈઝર)

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 12 of 16

https://archive.org/details/bk1417/page/n14/mode/1up

realpatidar.com

ગુરુ આદેશ વિચારી મનને મારો

- પ.પૂ. મહંતશ્રી જયરામદાસજી મહારાજ, શ્રી નિષ્કલંકી નારાયણધામ - નખત્રાણા.

"સંત સદા પરમાર્થી, શીતળ ઝાકા અંગ,
પ્યાસ બુઝાવે ઓરકી, દે દે અપના રંગ."
"મરના મરના સબ કહે, મરના ના જાણે કોઈ,
ગુરુજ્ઞાન વેધ્યા જે મરે, તેને ફરી મરણ ના હોય."

હે પ્રિય ભાવિકો; આ મૃત્યુલોક છે, જે જન્મે છે તે મરવાનો છે પરંતુ ઈષ્ટ સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજ એમ કહે છે કે -એ સાચું મરણ નથી. પાર્થિવ દેહ છોડ્યા પછી એ જીવાત્માને ચારે ખાણીમાં ભટકવું પડે છે. પણ જો સંતોના શબ્દોથી જેનું મન મરે તેને ફરી મરવું પડતું નથી ચારે ખાણીમાં ભટકવું પડતું નથી. હે સજ્જનો ! આ જીવ ઘણા જન્મોથી ભટકી રહ્યો છે તેનો અંત નથી. આ કલિયુગનો છેલ્લો સમય વરતાઈ રહ્યો છે. જો સમયની તક ચુક્યા તો પછી "ભવોભવ બુડંતે" માટે સંતોના શબ્દોને સમજવાની ખૂબ જ જરૂર છે. આ મન કેમ બગડે છે તે વાત ઋષિમુનિઓએ બતાવી છે. પાંચ જ્ઞાન ઈન્દ્રિયો પર કાબુ નથી, શીલ નથી. શ્રી શુકદેવજી મહારાજે ભક્તિસાગરમાં કહ્યું છે કે..

"શીલ ગુણ ઉંચી અતિ, ઉન્નતિ સો કે બીચ,
જો ઘટ શીલ ના આઈયા, સો ઘટ કહીએ નીચ."

આ મનનો વિષય છે. પાંચ શબ્દ સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ વિષયમાં એટલે ચંચલ ઈન્દ્રિયોમાં વિકાર આવવાથી મન બગડે છે તે કાબુમાં નથી આવતું અને જે જે કાર્યો થતાં હોય તેનું પરિણામ મળતું નથી એના માટે પણ કહ્યું છે કે;

"સબ શુભ લક્ષણ તો વિષે, શીલ ના આયા એક,
જપ તપ નિષ્ફળ જાયગા, ચરણદાસ વિવેક."

આજના સમયમાં માણસને એ વાત સમજમાં આવતી નથી કે આપણી ગફલત ભરી ભૂલનું શું પરિણામ આવશે. માટે હે સજ્જનો ! આપણા થતા સત્‌કર્મોનો આ નબળી ક્ષણ છે કે વાણી, વર્તન અને આહાર પર કોઈ અંકુશ નથી તેના કારણે ભક્તિના બહાને થતાં કાર્યો નિષ્ફળ જાય છે. આની સમજ નથી. મહાધર્મના નીતિ નિયમો ઘણા સારા છે પણ તેનો લાભ લઈ શકાતો નથી. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે કહ્યું છે કે; "ગફલતે ના સૂવો મારા મુનિવરો" તમારા આગળના દોષ માફ થઈ જશે. વર્તમાન સમજી લ્યો. આજે કલિયુગમાં અથર્વવેદના આધારે આ એક વાત કહી છે. માટે બુધ્ધિશાળી શાણા માણસોએ આનો પૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ. ભગવાનના દશ અવતાર અને માણસના ચોર્યાસી અવતાર કલિયુગના અંતે પુરા થતાં પાપ તથા પુણ્યનો હિસાબ આપવો પડશે ત્યારે આપણે હિસાબ આપવામાં ખોટા ના પડીએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પરમ કૃપાળુ પરમાત્માએ કૃપા કરી છે ત્યારે ભોગવિલાસ અને દોડાદોડી છોડી સાવધાન બની ગુરુ આદેશ વિચારી મનને મારો....

●●●

નિવેદન

સૌને જણાવતાં આનંદ થાય છે કે આપણા પ્રેરણાપીઠ તીર્થમાં નૂતન વર્ષ - સંવત ૨૦૭૦ના પ્રારંભથી દૈનિક સવારના ૬-૪૫ થી ૭-૪૫ કલાક સુધી સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે. અગણિત યાત્રાળુઓ દૈનિક સત્સંગનો ધર્મલાભ લઈ કૃતઘ્નતા અનુભવે છે. સત્સંગની પરબમાંથી ચાંગળુ (ખોબો) ભરી અમૃતરસનું રસપાન કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે.

પ્રેરણાપીઠ તીર્થમાં આવતા સૌ યાત્રાળુ - ભાવિક ભક્તજનોને આ દિવ્ય સત્સંગનો ધર્મલાભ લેવા નિવેદન છે.

realpatidar.com

email: mail@realpatidar.com

realpatidar.com

Patidar Sarvoday Trust

ટ્રસ્ટ રજી. નં. એ/૧૮૧૮/કચ્છ. તા. ૨૦/૧/૨૦૧૨

શ્રી પાટીદાર સર્વોદય ટ્રસ્ટ

પાટીદાર હોસ્ટેલ, ઉમિયા નગરની બાજુમાં, માંડવી-કચ્છ. ૩૭૦૪૬૫ ફોન નં. (૦૨૮૩૪) ૨૨૩૯૫૪

રૂ. નં.

તા. ૧૪/૧૧/૨૦૧૩

પાટીદાર સર્વોદય ટ્રસ્ટ માંડવી કચ્છ દ્વારા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઇઓ તથા બહેનોને જોગ જાહેર સ્પષ્ટતા.

વિક્રમ સવંત ૨૦૭૦ ના મંગળ પ્રભાતથી શરૂ થતાં નવા વર્ષ માટે શુભેચ્છા પાઠવતી અ.ભા.ક.ક.પાટીદાર સમાજ નખત્રાણા દ્વારા ઉમા દર્પણ અને પાટીદાર સંદેશના દિપોત્સવી અંકોમાં છપાયેલ જાહેરાત બાબતે સમાજના સર્વે ભાઇ બહેનોને સ્પષ્ટતા નીચે મુજબ કરી રહયા છીએ.

અ.ભા.ક.ક.પા સમાજ દ્વારા એવું લખવામાં આવેલ કે માંડવી મધ્યેની લખુભાઇ વીરજી ધોળુ વિધાર્થી છાત્રાલય વાળી મિલકત બાબતે નામદાર ચેરીટી કમીશ્નરશ્રી રાજકોટ દ્વારા સમાજની તરફેણમાં ચુકાદો આપેલ છે તેવું જણાવેલ છે, જે સદંતર સમાજને ગેરમાર્ગે દોરનારું છે. આ બાબતે સયકુંત ચેરીટી કમીશ્નરશ્રી રજકોટ સમક્ષ અપીલ નં. ૭૧/૨૦૧૨ વાળી મેટર આવેલ જે મેટરમાં નામદાર ચેરીટી કમીશ્નરશ્રી રાજકોટે પાટીદાર સર્વોદય ટ્રસ્ટ વાળી મિલકત માટે કોઇ વિશેષ પુરાવા કે રજુઆત હોય તો તે માટે અ.ભા.ક.ક.પા. સમાજને તક આપેલ છે નહી કે અ.ભા.ક.ક.પા. સમાજના નામે મિલકત ચડાવી દેવા માટે હુકમ કરેલ અને ઉપરાંતમાં પાટીદાર સર્વોદય ટ્રસ્ટના પી.ટી. એન્ટ્રી ફોર્મમાં સદર મિલકત યથાવત રાખેલ છે. આમ આજ પણ ચેરીટી કમીશ્નરના ચોપડે સદર મિલકત પણ પાટીદાર સર્વોદય ટ્રસ્ટની છે. ઉપરાંતમાં અ.ભા.ક.ક.પા. સમાજ દ્વારા પાટીદાર સર્વોદય ટ્રસ્ટ સામે ચેરીટી કમીશ્નરશ્રી સમક્ષ મનાઇ હુકમનો કેસ નં. ૪૧/૨૦૧૩ પણ ઉઠાવી લીધેલ છે અને પાટીદાર સર્વોદય ટ્રસ્ટના ફેવરમાં ચુકાદો આવેલ છે.

વધારામાં નાયબ કલેકટરશ્રી મુંદરા દ્વારા પણ સદર મિલકત બાબતે તા.૨૧/૦૫/૨૦૧૩ ના રોજ કેસ નં. ૧૩/૨૦૧૩ વાળી મેટર પાટીદાર સર્વોદય ટ્રસ્ટની ફેવરમાં હુકમ કરી આપેલ છે.

અ.ભા.ક.ક.પા સમાજના પ્રમુખશ્રી દ્વારા નવા વર્ષેના અભિનંદન સાથે પણ વિવાદાસ્પદ બાબતો ને લઇ ને ખોટા સમાચાર સમાજમાં પ્રસરાવે છે અથવાતો પ્રમુખશ્રીને સમાજનું મંત્રી મંડળ કે તેમના વહીવટીદારો ગેર માર્ગે દોરી સાચી હકીકતોને છુપાવી સમાજના પ્રમુખને અને સમાજને ગુમરાહ કરે છે.

માટે સમાજના ભાઇઓને બે હાથ જોડી નમ્ર પ્રાથના છે કે કોઇ અપ પ્રચારથી દોરાઇ ન જઇ ને સમાજની એકતા અને પરસ્પર એકબીજાનો પ્રેમ કાયમ રહે અને સંપ રહે એવી માં ઉમાના ચરણોમાં અમારી પ્રાર્થના.

પાટીદાર સર્વોદય ટ્રસ્ટ, માંડવી-કચ્છ

realpatidar.com

realpatidar.com

૧૦૦૦૦ થી વધુ મંત્રજાપ સંખ્યા જે યુવાનો તથા વડીલોની છે તેમની ફોટા સાથે નામાવલી

નર્મદાબેન વી. રામાણી
પંચવટી-નાસિક
જાપ સંખ્યા - ૨૦૦૦૦

પ્રેમીલાબેન એમ. પટેલ
બાલાસિનોર, જી. ખેડા
જાપ સંખ્યા - ૫૦૦૦૦

દિવ્યાબેન એસ. વાસાણી
નાની વિરાણી -માંડવી
જાપ સંખ્યા - ૧૩૧૭૫

પાર્વતીબેન બી.વાસાણી
નાની વિરાણી - માંડવી
જાપ સંખ્યા - ૧૦૬૫૬

હંસાબેન ડી. લીંબાણી
દેવપર (યક્ષ) - નખત્રાણા
જાપ સંખ્યા - ૧૦૧૬૮

જીજ્ઞાબેન એમ. ભોજાણી
રત્નાપર (મઉ) માંડવી
જાપ સંખ્યા - ૧૦૧૬૮

સવિતાબેન કે. પારસીયા
નવજીવન ફાર્મ -ધનસુરા
જાપ સંખ્યા - ૧૦૧૬૮

મંજુલાબેન આર. પટેલ
મોડાસા - અરવલ્લી
જાપ સંખ્યા - ૧૦૧૬૮

જયશ્રીબેન એન. પટેલ
સુભાનપુરા - વડોદરા
જાપ સંખ્યા - ૧૦૧૬૮

કમળાબેન આર. પટેલ
સુભાનપુરા - વડોદરા
જાપ સંખ્યા - ૧૦૧૬૮

તરૂણાબેન વી. પટેલ
નારણપુરા -નડિયાદ
જાપ સંખ્યા - ૧૦૧૬૮

પાર્વતીબેન એમ. પટેલ
શીવનગરફાર્મ - દહેગામ
જાપ સંખ્યા - ૧૦૧૬૮

સુમિત્રાબેન એ. પટેલ
સુભાનપુરા - વડોદરા
જાપ સંખ્યા - ૨૦૦૦૦

નર્મદાબેન એસ. પટેલ
ગંગાવતી - કર્ણાટક
જાપ સંખ્યા - ૧૦૧૬૮

ગંગાબેન ડી. નાકરાણી
સંકેશ્વર - કર્ણાટક
જાપ સંખ્યા - ૧૦૧૬૮

ગૌરીબેન એસ. પોકાર
જીયાપર - નખત્રાણા
જાપ સંખ્યા - ૧૦૧૬૮

ભાવનાબેન એન. પટેલ
નારણપુરાલાટ - નડીયાદ
જાપ સંખ્યા - ૧૦૧૬૮

સુશીલાબેન જે. પટેલ
ભવાનીપુરાકંપા - મોડાસા
જાપ સંખ્યા - ૬૦૦૦૦

સુરેશભાઈ એચ. નાકરાણી
મણીનગર - નખત્રાણા
જાપ સંખ્યા - ૧૦૧૬૮

લધ્ધાભાઈ એન. ધોળુ
દુર્ગાપુર - માંડવી
જાપ સંખ્યા - ૧૦૧૬૮

દિનેશભાઈ જે. પટેલ
અલકનંદા સો. - અંકલેશ્વર
જાપ સંખ્યા - ૧૦૧૬૮

સુરેશભાઈ બી. વાસાણી
નાની વિરાણી -માંડવી
જાપ સંખ્યા - ૧૭૩૮૪

ભીમજીભાઈ વી. વાસાણી
નાની વિરાણી - માંડવી
જાપ સંખ્યા - ૧૦૬૫૬

જીતેન્દ્રભાઈ કે. અંધારિયા
આનંદનગર -ભાવનગર
જાપ સંખ્યા - ૧૦૧૬૮

રાજાભાઈ આર. પટેલ
ઉમિયાનગર - હળવદ
જાપ સંખ્યા - ૧૦૧૬૮

લખમશીભાઈ ડી. પટેલ
બડોલકંપા - વડાલી
જાપ સંખ્યા - ૧૦૧૬૮

રમણભાઈ એન. પટેલ
મોડાસા - અરવલ્લી
જાપ સંખ્યા - ૧૦૧૬૮

અંબાલાલ એમ. પટેલ
નારણપુરાલાટ - નડીયાદ
જાપ સંખ્યા - ૧૦૧૬૮

સાકરલાલ વી. મહારાજવાળા
ભેગમપુરા - સુરત
જાપ સંખ્યા - ૧૦૧૬૮

વાડીભાઈ એસ. પટેલ
વસ્તોલકંપા - વડાલી
જાપ સંખ્યા - ૧૨૫૦૦૦

realpatidar.com

https://archive.org/details/bk1417/page/n17/mode/1up

realpatidar.com

Registered under RNI No. GUJ - GUJ - 2012/42296. Dt. 18/05/2012.
Registered Under Postal Registration No. GAMC - 1830-2012-2014 By S.S.P. Ahmedabad City DN
Valid up to 31st December 2014. Posted on 15th Every Month from PSO Patrika Channal Ahmedabad - 380002.
દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતુ માસિક

આ અંકના વિશિષ્ટ સહયોગી જ્ઞાનદાતા

"સત્પંથ પ્રકાશ"ના ડીસેમ્બર - ૨૦૧૩ના અંક માટે રૂા. ૧૧૦૦૦/- (અંકે રૂપિયા અગીયાર હજાર)નો આર્થિક સહયોગ "જ્ઞાનદાતા" સ્વ. શ્રી મણીભાઈ જેઠાભાઈ પટેલ પરિવાર હ. શ્રી કેશુભાઈ એમ. પટેલ - મુ. દુધાથલ લાટ, તા. કપડવંજ તરફથી પ્રાપ્ત થયેલ છે. સત્પંથ પ્રકાશન સમિતિ તેઓશ્રીના આ "જ્ઞાનદાન"નો સહર્ષ સ્વીકાર કરે છે.

શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન અને સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની કૃપા સદાય તેમના ઉપર રહે તેવા પ.પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ તથા સંપાદક શ્રી શામજીદાદાના અભિનંદન સહ આશીર્વાદ.

રવાના :
સતપંથ પ્રકાશ
સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ - ૩૮૨ ૪૨૫.

To, ______________________

Printed, and Published by **SHAMJIBHAI K. PATEL on behalf of Satpanth Prakashan Samiti** and Printed at **Smruti Offset,** B/5, Ravi Estate, Rustom Mill Compound, Near Torrent Power, Near Water Tank, Dudheshwar, Ahmedabad - 380 004 and published from Satpanth Prakashan Samiti, Shri Satpanth Premapith, At - PIRANA - 382 425, Taluka - Dascroi, Dist. Ahmedabad.
Editor - **SHAMJIBHAI K. PATEL**

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com